

Ref: No. ABCL/SD/MUM/2024-25/AUGUST/07

2 August 2024

BSE LimitedPhiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai 400 001**Scrip Code: 540691****Scrip ID: ABCAPITAL****National Stock Exchange of India Ltd**Exchange Plaza, 5th Floor,
Plot. C/1,
G-Block, Bandra-Kurla Complex,
Bandra (East),
Mumbai 400 051**Symbol: ABCAPITAL**

Dear Sir/ Madam,

Sub: Intimation under Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Pursuant to Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached the newspaper advertisements regarding the Unaudited Financial Results of the Company for the quarter ended 30 June 2024 published in Business Standard (All Editions) and Sandesh (Rajkot edition) on 2 August 2024.

The same shall be uploaded on the Company's website <https://www.adityabirlacapital.com/>.

The above is for your information, records and dissemination please.

Thanking you,

Yours sincerely,

For **Aditya Birla Capital Limited****Santosh Haldankar****Company Secretary & Compliance Officer****Encl.: As above****Cc:****Luxembourg Stock Exchange**Market & Surveillance Dept.,
P.O. Box 165, L-2011 Luxembourg,
Grand Duchy of Luxembourg**Citi Bank N.A.**Custodial Services
FIFC, 11th Floor, C-54 & 55, G Block
Bandra Kurla Complex
Bandra (East), Mumbai 400 051**Citi Bank N.A.**Depository Receipt Services
388 Greenwich Street
14th Floor, New York,
NY 10013**Listing Agent**Banque Internationale à Luxembourg SA
69 route d'Esch
L - 2953 Luxembourg
Grand Duchy of Luxembourg

SHREYA NANDI & ARYAMAN GUPTA
New Delhi, 1 August

Magicip, the hyper-local discovery platform, had a slow start. Things changed once it joined the Open Network for Digital Commerce (ONDC) in March 2023, not just acting as a buyer app but also fulfilling the backend logistics related to orders and delivery. Going toe to toe with food delivery majors by offering cheaper prices for the same items, Magicip began to pull in around 20,000 orders a day, much more than some better known outfits, which were getting roughly 5,000 orders a day.

It is now the largest food aggregator platform on the ONDC network. "Most of the delivery orders on the network are coming from Magicip. The platform has grown to a double-digit market share in many localities of Delhi and Bengaluru. Overall, in these cities, the company is in high single digits. This number has grown 10-fold over the last year," said a person familiar with the matter.

Magicip CEO Anshoo Sharma told Business Standard the growth had come on the back of its seller base. "The reason it (ONDC) has worked is because the merchant ecosystem wants this to exist. The way it is growing, by the end of the year, ONDC will have made a meaningful impact in the food delivery category," he said.

Sharma is not the only one extolling ONDC's role in the way ecommerce is evolving in India.

Saahil Goel, CEO of ecommerce logistics unicorn Shiprocket, says his company's business through the platform has grown more than 10-fold since its integration with ONDC in June last year, when it became one of the first large seller apps to integrate with the network. "Though the base is still small, growth has been rapid. We are already one of the largest catalogue suppliers to ONDC and among the largest seller apps," says Goel, adding that the company now has more than 10,000 sellers.

In the beginning, it was difficult to integrate with the network, but the problem has been addressed.

The Economic Survey, which was tabled in Parliament the day before the Union Budget, cited Sri Vidhya Handlooms in Kanchipuram, Tamil Nadu, as having transitioned to digital commerce via ONDC. As a result, the family-owned business expanded its reach to 54 cities. Monthly revenues rose to nearly ₹2 lakh, compared to previous earnings of ₹10,000-20,000 on mainstream platforms. Lower commission rates on ONDC enhanced profitability.

"Sellers are very keen on seeing their products listed on the various buyer side platforms like Paytm and others. Aside from sales, the network is also providing them with a lot of branding. Most of the sellers now do not require much input. After familiarising them with the ONDC panel and telling them about the benefits, they now just require a support call once in a while. There has been a general interest in exploring the network," says Goel.

With the boom in ecommerce in India, concerns arose about the seeming lack of a level playing field between the cash-rich e-tailers and the small offline stores. The ONDC was born out of this.

Level playing field

Initiated by the Department for Promotion of Industry and Internal Trade (DPIIT) three years ago, ONDC promotes open networks for exchange of goods and services digitally. Its platform-agnostic architecture allows buyers and sellers to transact irrespective of the platform they use.

"ONDC is an inclusive agenda, giving a level playing field to existing players like Amazon, Flipkart, Ola, Uber, Swiggy, Zomato, etc., as well as to small startups and players like artisans, FPOs, SHGs, kirana stores etc," T Koshy, ONDC's MD and CEO, told Business Standard in an interview.

The government believes this will increase visibility for products and services, resulting in additional revenue for sellers, and aid onboarding of small, local sellers so they can take advantage of the ecommerce boom.

"We're not trying to replace



WITH OPEN ARMS

How far can ONDC democratise ecommerce in India?

MD and CEO T Koshy (pictured) says that ONDC is an inclusive agenda, giving a level playing field to existing players as well as to small startups and players like artisans, FPOs, SHGs, kirana stores etc

anybody, but collaborate and co-exist, benefiting everyone. This is similar to physical markets, where big players and small players thrive side by side, both adding value and catering to their particular segments," Koshy said.

ONDC is currently fully operational across more than 1,200 cities, with the digital infrastructure completed and rolled out to businesses and the public at large. More than 535,000 sellers have been onboarded on the platform, of which 85 per cent are small sellers. In June, ONDC facilitated 9 million transactions.

It operates across broad categories, such as food and beverage, grocery, agriculture, fashion and footwear, home and kitchen, electronics, beauty and personal care, mobility, financial services. The adoption has been the most across mobility, grocery, and food, as well as fashion.

No cakewalk

A Parliamentary standing committee report in 2022 had stated that ONDC's success was contingent upon factors such as successful onboarding of the existing digital commerce apps and platforms, compatibility and interoperability of the existing applications of the buyers and sellers, and the technical capability of small and medium enterprises to be onboarded on the digital network.

For instance, fintech major PhonePe's journey with ONDC has not been smooth. In July last year, it launched its ecommerce app, Pincode, on ONDC in 10 cities, offering grocery, food, medicines, fashion, electronics, etc. Nine months later, it exited non-food categories such as fashion and electronics. Meanwhile, it continues to operate in the travel ticketing segment on ONDC through its main app.

Though the company had then said it was realigning its focus more on hyperlocal segments, such as food delivery and grocery, people in the know say the end consumer's experience on the platform was not perfect.

"It is still early days for the network. If ONDC can scale up quickly, it will be able to iron out the kinks and more apps would be keen to list on the platform. We are also in regular talks with them," says a top executive of a food delivery firm.

Food delivery is no problem. Several restaurants, owing to platforms like Swiggy and Zomato, have acclimatised to the process of food delivery — from managing inventory to packaging food. But the neighbourhood kirana stores are yet to reach similar levels of standardisation, contributing to product returns, according to a person familiar with the matter.

THE STORY SO FAR

■ First meeting of the nine-member advisory Council: **July, 2021**

■ Date of incorporation: ONDC was incorporated as a non-profit company on 31 December, 2021

■ Number of transactions since inception: **68 million**

1200+ Cities **535,000+** Sellers **85%** Small sellers

■ Number of transactions per month: **9 million**

65 Seller applications **22** Buyer applications **12** Logistics service providers

■ Key domains: Mobility, food and beverage, grocery, fashion, beauty and personal care, logistics, agriculture, Farmer Producers Organisations (FPOs), among others



What is ONDC?

ONDC intends to transform the ecommerce space the way UPI changed digital payments. It works on the principle of open network, where a buyer and a seller don't have to be on the same platform to conduct business with each other. Rather, the network will enable them to be digitally visible and transact, no matter what platform or application they use.

It works with a common catalogue, where a seller doesn't need to follow a separate set of compliances for different marketplaces. Similarly, consumers can see sellers from all marketplaces such as Amazon and Flipkart, and even their neighbourhood stores. Over a period of time, the hope is that there will be rapid digitalisation of small businesses and consumers.

यूनियन बैंक ऑफ इंडिया Union Bank of India		Possession Notice	
POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTIES (Under Rule 8(1) Security Interest Enforcement Rule 2002)			
Whereas the Authorised Officer of Union Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement Security Interest Act 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices calling upon the borrower(s) mentioned below to repay the amount mentioned in the demand notices within 60 days from the date of receipt of the said notices.			
The borrower(s) having failed to repay the amounts, notice is hereby given to borrower(s) and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rules on the dates mentioned below.			
The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Union Bank of India for the amount mentioned below. The borrower's attention is invited to the provision of Sub Section 13(8) of the Act, in respect of time available to redeem the secured assets.			
Name of the Borrowers/Guarantor	Details of the Property	Dt. of Demand Notice	Dt. of Possession
Branch: Firozabad			
Borrowers- 1) Mrs. Priyanka Yadav W/o Mr. Shyam Singh Yadav, 2) Mr. Shyam Singh Yadav S/o Mr. Vijendra Singh, Add. of Both- H. No. 121, New Labour Colony Nagla Vishnu, Near Samam Singh ITI Firozabad	All that part and parcel of the property being H No-121, Nagla Vishnu New Labour Colony, Mauza- Datuji Line Par Firozabad, Area: 97.65 Sq. Mtr., in the name of Mrs Priyanka Yadav W/o Shri Shyam Singh Yadav, Bounded as: East- plot of siyaram and, West- Gali rasta 20 feet wide, North- Plot of purushottam, South- Gali rasta 12 feet wide	01.02.2024	30.07.2024
Borrowers- M/s Sufi Ji Bangle House Prop. Hassan Kamal S/o Sufi Manzur Hasan, Add- House No. 134, Situated at mohalla Rajputana Akaswani Road, Near Bismillah Marriage Home city & District- Firozabad, Guarantor- Mr. Abrar Hasan s/o Quamrudin, Add.- 39, Nala Vandan Firozabad	1) All that part and parcel of Residential Property situated at Nagar Palika No.134, Mohalla Rajputana, District Firozabad, Area: 69.52 Sq. Mtr., in the name of Hasan Kamal S/o Late Sufi Manjur Hasan, Bounded as: East- 3 ft gali rasta, West- 15 ft gali rasta, North- House of Rati Ram, South- 6 ft gali rasta 2) All that part and parcel of Residential Property situated at Nagar Palika No. 28, Habibganj Didamai, District Firozabad, Area: 74.40 Sq. Mtr., in the name of Hasan Kamal S/o Late Sufi Manjur Hasan, Bounded as: East- Plot of Bhure, West- Plot of Siraj, North- Gali rasta 10 ft, South- Plot Idrish	26.04.2024	30.07.2024
Borrowers- Mr. Sunil Kumar S/o Prem Pal Singh, Add.- Naley ki puliya jhalkari Nagar jalesar Road, Firozabad, Guarantor- Mr. Anil Kumar S/o Prem Pal Singh, Add.- Gram Ghadi Ranchor Post-Jondhari Tundia Firozabad	All that part and parcel of Residential Property situated at Mauja Shukhmalpur Nizamabad Now Sudama Nagar, Firozabad, Dist- Firozabad, Area: 93.00 Sq. Mtr., in the name of Mr. Sunil Kumar S/o Prem Pal Singh, Bounded as: East- 12 ft wide road, West- prop. of Shanti Devi, North- 15 ft wide road, South- prop. of Pushpa devi	16.04.2024	30.07.2024
Borrowers- Ms Tasleem Begum W/o Late Mohd Yasin Estate of the deceased Mohd. Yasin S/o Ismail represented by Mr. Mohd. Kasim S/o Late Mohd. Yasin (Son) Mrs. Tasleem Begum W/o Late Mohd. Yasin and others, Guarantor- Mr. Mohd Kasim S/o late Mohd. Yasin Add. of all- 39, Kidwai Palace, Sadar Bazar, Firozabad	All that part and parcel of Residential Property Comprised H. No. 203/19 situated at Sadar bazar south Kidwai palace lehsil and district Firozabad, Area: 30.66 Sq. Mtr., in the name of Mohd. Yasin S/o Mohd. Ismail, Bounded as: East- prop. of Nasir, West- prop. of Jarina, North- Gali rasta, South- prop. Babu Ram Paliwal	16.04.2024	30.07.2024
			Amount Due (Rs.)
			8,11,025.58 as on 29.01.2024 + interest & other Exp.
			21,53,179.22 as on 26.04.2024 + interest & other Exp.
			11,33,370.33 as on 16.04.2024 + interest & other Exp.
			13,87,313.10 as on 16.04.2024 + interest & other Exp.
Date 02-08-2024		Authorised Officer	

Aditya Birla Capital Limited



Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat | Tel: 91 2876 243257
CIN: L67120GJ2007PLC058890 | www.adityabirlacapital.com | abc.secretarial@adityabirlacapital.com

AN EXTRACT OF THE CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE 2024

(₹ crore except per share data)

Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
	30 th June 2024 (Unaudited)	31 st March 2024 (Audited)	30 th June 2023 (Unaudited)
Total Revenue from Operations	8,832.43	34,505.54	7,044.97
Net Profit for the period Before Tax	1,074.33	4,582.36	911.52
Net Profit for the period After Tax (including Non-Controlling Interests)	779.24	3,438.89	665.70
Net Profit for the period After Tax attributable to the Owners of the Company	758.84	3,334.98	648.76
Total Comprehensive Income for the period attributable to Owners of Company [Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)]	758.68	3,355.92	659.38
Paid-Up Equity Share Capital (Face Value of ₹ 10 each)	2,602.08	2,600.02	2,594.70
Earnings per Share of ₹ 10 each (A - not annualised)			
(a) Basic - (₹)	2.92 ^A	13.05	2.68 ^A
(b) Diluted - (₹)	2.89 ^A	12.95	2.66 ^A

Notes:

1 During the quarter ended 31st March 2024, the Company had sold 1,39,94,199 Equity Shares of Aditya Birla Sun Life AMC Limited ("ABSLAMC") representing 4.86% of the issued and paid-up equity share capital of the ABSLAMC, by way of an offer for sale through stock exchange mechanism. The Company has recognised gain amounting to ₹ 486.43 crore (Net of Tax, Gain is ₹ 433.00 crore) in the quarter ended 31st March 2024. Further, during the quarter ended 30th June 2024, the Company has sold 3,90,728 Equity Shares of ABSLAMC, representing 0.14% of the issued and paid-up equity share capital of the ABSLAMC, in open market. The Company has recognised gain amounting to ₹ 16.13 crore (Net of Tax, Gain is ₹ 14.30 crore).

As a result, ABSLAMC has achieved the minimum public shareholding as required under the applicable laws. The shareholding percentage of Aditya Birla Capital Limited in ABSLAMC stands at 45.00% as on 30th June 2024.

2 The Board of Directors of the Company, at its Meeting held on 11th March 2024, approved the Scheme of Amalgamation ("Scheme") of Aditya Birla Finance Limited ("Amalgamating Company") (a wholly owned subsidiary of the Company) with the Company and their respective shareholders and creditors under Sections 230 to 232 read with other applicable provisions of the Companies Act, 2013 and the rules framed thereunder. The Scheme is subject to the sanction of National Company Law Tribunal ("NCLT"), Ahmedabad Bench and receipt of necessary approvals from the Reserve Bank of India, shareholders/creditors as may be directed by the NCLT and such other regulatory/statutory authorities, as may be required.

3 The Board of Directors of the Company, at its Meeting held on 27th March 2023, has approved the sale of its entire stake of 50.002% of the issued and paid-up share capital of Aditya Birla Insurance Brokers Limited to Edme Services Private Limited, part of the Samara Capital Group and an affiliate of Samara Alternate Investment Fund.

The proposed transaction was subject to condition precedent, including the receipt of approval of Insurance Regulatory and Development Authority of India ("IRDAI") and other regulatory/statutory approvals and satisfactory compliance of other conditions under the Share Purchase Agreement.

IRDAI vide its letter dated 24th July 2024 has approved the proposed transaction, to be carried out within 60 days from the date of approval. Upon completion of the proposed transaction, ABIBL shall cease to be a subsidiary of the Company.

4 The Company during the financial year 2023-24, issued share capital through Qualified Institutional Placement of 10,00,00,000 shares to Qualified Institutional Buyers and through Preferential Issuance of 7,57,11,688 shares to its Promoter and a member of Promoter Group entity, both aggregating to ₹ 3,000 crore. In accordance with Ind AS 32, the costs that are attributable directly to the above transaction have been adjusted against securities premium reserve.

5 The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company, at their Meetings held on 1st August 2024.

6 The standalone financial results are available at Company's website viz. www.adityabirlacapital.com and on the websites of BSE (www.bseindia.com) and NSE (www.nseindia.com). Key Standalone financial information is as indicated below:

(₹ Crore)

Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
	30 th June 2024 (Unaudited)	31 st March 2024 (Audited)	30 th June 2023 (Unaudited)
Revenue from Operations	60.75	859.57	9.43
Profit for the period Before Tax	46.79	795.34	0.69
Profit for the period After Tax	37.71	714.28	0.52
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)]	37.91	714.15	0.62

7 The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.adityabirlacapital.com.

For and on behalf of the Board of Directors of Aditya Birla Capital Limited

Kumar Mangalam Birla
Chairman
DIN: 00012813

Place : Mumbai
Date : 1st August 2024

An Aditya Birla Group Company

સકરભાગ મૂ માથી એક સિદ્ધી જોડી રાજસ્થાનના મૂળી શોભા વધારશે

ઉદયપુરથી ચિંકારા, શિયાળ, ઝરખ સહિતના ૧૪ પ્રાણીઓ જૂનાગઢ આવ્યા

એનીમલ એક્સચેન્જ યોજના અન્વયે પ્રાણીઓની આપ-લે



જૂનાગઢ : એનીમલ એક્સચેન્જ યોજના અન્વયે જૂનાગઢ સકરભાગ મૂ માથી સિદ્ધી એક જોડીના બદલામાં ઉદયપુરના સજીવનગઢ મૂળી શોભા વધારવા કુલ ૧૪ પ્રાણીઓ જૂનાગઢ મૂ માં લાવવામાં આવ્યા છે. જે આગામી સમયમાં પ્રવાસીઓ માટે રિસ્કમાં મુકવામાં આવશે.

લોહડા ગામે અરજીના કામે ગયેલ આજી કેમ પોલીસ ઉપર હુમલો 'ગામમાં આવશો તો જીવતા જવા દઈશું નહિ' કહી પથ્થરમારો, પાઈપના ઘા ઝીકી દેતા કોન્સ્ટેબલને ઈજા

રાજકોટની પરિશીતા દ્વારાકામાં લાપતા

રાજકોટ : રાજકોટની પરિશીતા દ્વારાકામાં લાપતા પુત્ર જયેશને ગામીમાં બેસાડી ઈપા બેસાડી પોલીસને બંને મહિલા આરોપીને પકડી ગામીમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવી ચારેય સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

કરજમાં રૂકાવટનો ગુનો નોંધી પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ

રાજકોટના આજી કેમ પોલીસનો સ્ટાફ લોહડા ગામે અરજીના કામે તપાસમાં ગયો હતો ત્યાં ગેરેજ બાહુ વિષે પૂછતાં તેના પુત્ર મુશ્કેલી પાતાલ બહાર ગયા છે તેમ કહી વાળા જઈ કોર્ટને લેવા કરી કહેલ કે ગેરેજ પાસે પોલીસ આવી છે બધા તેવારીમાં આવજો તેમ વાત કર્યા બાદ મુશ્કેલી ઘરમાં પાવડને અને લોખંડનો પાઈપ લઈને માતા અને ભાભી સાથે આવ્યો હતો અને તેમ પોલીસવાળા ફરિયાદીઓ સાથે મળ્યા છતાં અમને ખોટી કોર્ટ દરમિયાન કરતાં છો કહી ગયાં કરતા અમને સુધી બાબુભાઈ મકાનવાળા તેનો પુત્ર જયેશ, માતા શાંતાબેન અને ભાભી બાબુબેન સામે આજી કેમ પોલીસમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોર્ટમાં સોલ્વન્ટમાં રહેતા અને લોહડામાં નોનવેજની કેમીન ધરાવતા ફરિયાદીઓ સહીમયાઈ સોલ્ડીએ બાબુમાં ગેરેજ ધરાવતા બાબુ હુમલો કરતા તેના પુત્ર, કેમીન અહીં રાખવી નહિ કહી ગયાં કરતા હોય જેથી અરજી કરી હતી જેનું નિવેદન નોંધવા બાબુભાઈ અને સાંભળેને બોલાવતા તેમને આવવાની ના પાડી

પુત્ર જયેશને ગામીમાં બેસાડી ઈપા બેસાડી પોલીસને બંને મહિલા આરોપીને પકડી ગામીમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવી ચારેય સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સરદાર ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સરદારી એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ છુપનાભાઈ બંને પત્ની સહિકાબેન લાપતા થવા અને દ્વારકા પોલીસ મથકમાં કસ્ટી અરજીમાં જણાવ્યું હતું કે ગત ૧૮ તારીખે સવારે પત્ની જયમનર જયનું કસ્ટી નીકળી હતી બાદમાં અમાર બંને વચ્ચે સંજોગ ઘવાયા સુધી લેવામાં લાવવાની કસ્ટી હતી તે પછી તેણી લેવા લાવવા દ્રારકા પોલીસનો સંપર્ક થયો હતો પોલીસે આ મોબાઈલ અને ચેલો દ્વારકા પોલીસ યાત્રા ઉપરથી રેકા નમ્યા હોવાનું જણાવતા પોતે તાબડોલે ૨ ૧ તારીખે દ્વારકા ઈસ્ટી ગયા હતા અને શ્રોત્રાભાગ કરવા છતાં પત્નીનો કોર્ટ ખેંચી લાવવાનો પોલીસમાં અરજી કરી હતી જો કે ૧૪ ડિસેમ્બરે જ્યાં હોવા છતાં કોર્ટ સંપર્ક નહિ તથા પોલીસ ત્વરિત કામગીરી કરે તેવી માંગ પરિવરણનો કરી રહ્યા છે.

ઉપલેટા પંચકા સાત ગામમાં સર્વેની કામગીરી પુરી પૂર અસ્ત ઉપલેટાના ૧૭, થોરાજના ૧૮ ગામોએ રાહત પેકેજ માગ્યું

ઉપલેટા અને થોરાજ પંચકામાં પરિવાર ભારે વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં આ પંચકામાં નુકસાની થઈ છે. રસ્તા, પાક, જમીન અને વેકેંડમ સહિતની નુકસાનીનો તાગ મેળવવા માટે સરકારી તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. કેટલાક ગામમાં વધુ નુકસાની હોવા આ ગામોએ રાહત પેકેજની માગણી કરી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, થોરાજના ૧૮ ગામ અને ઉપલેટાના ૧૭ ગામમાં વરસાદના કારણે મોટાપાયે નુકસાન થયું હોવા અહેવાલ થયેલ રહેલ છે અને તે સર્વે છે. આંખે ગામોએ સરકાર સાચી રહ્યો છે. રસ્તા, જમીન ધોવાણ, પાક, વેકેંડમ સહિતની નુકસાની સર્વે ચાલુ

રાજુલા પાસે સિંહલોને ભોગ લેવા ઝોઝાર ટ્રેક પર ટ્રેન હડકોટે ચાર ગાઈ ઈબાગરત

રાજુલા : રાજુલા નજીક ભાવનગર સોમનાથ હાથે ધર ભેરાઇ રહેલે ટ્રેકને ગામોને ગુસ્સા દેને ટકકર મારતા ૨ ગામોને ઈબાગરત થઈ છે. અને ૨ ગામોની હાલત અત્યંત ગંભીર હોવાનું અને ઊલન મથા એવો સ્વેચ્છા ભોગ લેવાનું જાણવા મળેલ છે. રાજુલા પુત્ર બાબુ ગોળામાં ઈબાગરત કરવામાં આવતા એએચબીએ ઓફ ઇન્ડિયા સ્થળે ટોડી ગઈ હતી અને ઈબાગરત ગામોને સારવાર માટે લઈ જવામાં આવી હતી. ટ્રેનની સ્પીડ ઠીક ઉપર લોકોની આશંકા સેવાઈ રહી છે. આ રેલવે ટ્રેક પર ટ્રેનની અકસ્તે સિંહનો મોતની ઘટનાનો સિલસિલા ચલકાતો ન હોવાથી લોકોમાં ભારે ટોળી લાગતી જવા મળે છે. ઇન્ડિયાન ગોળાને ટ્રેન ટકકર મારતા શ્રાવણ માસ પૂર્વે ગામોએ મોઝે દુઃખ વ્યક્ત કરી આવી ઘટના ન બને તે માટે રેલવે અને વનવન અસરકારક પગલા ભરે તેવી માંગ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિ.-રાજકોટ પોલીસ વચ્ચે વધુ એક એમ.ઓ.યુ. સાર્ઠન થયા હવે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને વેલ્યુ એડેડ કોર્સ તરીકે 'સાયબર એજ્યુકેશન' ભણવાનો મોકો

પોલીસ દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો: CP-VCએ કરાર કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વધુ એક વેલ્યુ એડેડ કોર્સના કરાર કરવામાં આવ્યા છે. જેમાં ટૂંકકે બાદ હવે યુનિ. અને પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમ અનુસાર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાયબર એજ્યુકેશનનો કોર્સ કરી શકશે. જેના પર આરજીજી CP-VCએ સાર્ઠન કરી મહોર લખાવી હતી. નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થયેલા સ્ટાન્ડર્ડ ઓરિએન્ટેડ પોલિસ મુજબના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટેની નોન ક્રાઉન્સિલ હેઠળની વિવિધ વિદ્યાશાખાઓ અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ નેકા સ્ટાન્ડર્ડ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં વેલ્યુ એડેડ કોર્સ દાખલ કરવા હેતુર 'સાયબર એજ્યુકેશન' વિષય અંક ડેકા પાટ ન અને પાટ ટુ એવા બે અભ્યાસક્રમો માટે આરજીજી યુનિવર્સિટી સેન્ટર ઓફ સાયબર સ્ટુડીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કુલપતિ ડી.કે.વલ્લભ

Advertisement for Indian Standard Bureau Rajkot, featuring a logo and text about standards and certification.

Advertisement for Aditya Birla Capital Limited, showing financial results for the quarter ended 30th June 2024.

Advertisement for Bank of Baroda, featuring a digital account and smart services.